

[1/A-1]
E+6

SEAT No. _____

No. of Printed Pages: 5



SARDAR PATEL UNIVERSITY
BCOM IInd SEM [CBCS]
ADVANCED ACCOUNTING AND AUDITING -III [UB02ECOM01]
THURSDAY, 6TH October 2022
09.30 AM TO 11.30 AM

MARKS: 60

ATTEMPT ANY FOUR QUESTIONS FROM THE FOLLOWING
ALL QUESTIONS CARRY EQUAL MARKS

Q1A Explain the provision of companies Act for Redemption of Redeemable Preference Shares.

[05]

Q1B. Calculate the amount to be transferred to Capital Redemption Reserve Account in each of the following cases:

[10]

Redeemable Preference Shares	Fresh Issue of Shares
1. Rs. 500000 to be redeemed at par	Rs. 300000 at par
2. Rs. 500000 at a premium of 5%	Rs. 300000 at par
3. Rs. 500000 redeemable at par	Rs. 300000 at a premium of 10%
4. Rs. 500000 redeemable at par	Rs. 300000 at a discount of 10%
5. Rs. 500000 redeemable at a premium of 5%	Rs. 300000 at a premium of 10%

Q2. The following is the Balance-Sheet of Bharat Company Limited as on 31st March 2022. [15]

Liabilities	Amount [Rs.]	Assets	Amount [Rs.]
Share Capital:		Fixed Assets:	
Authorised:		Land and Building	75000
20000 shares of Rs. 10 each <u>200000</u>		Plant and Machinery	45000
Subscribed:		Current Assets:	
10000 Equity Shares of Rs. 10 each	100000	Sundry Debtors	35000
3000 5% Redeemable Preference Shares of Rs. 10 each	30000	Stock in Trade	25000

[P.T.O.] (1)

Reserves and Surplus:		Cash on Hand	20000
Capital Reserve	20000		
General Reserve	12000		
Profit and Loss Account	15000		
Current Liabilities and Provisions:			
Sundry Creditors	23000		
	200000		200000

The company decided to issue 2000 Equity shares of Rs. 10 each at a premium of Rs. 2 per share for cash and to redeem at par 3000 5% Redeemable preference shares. You are required to pass necessary Journal Entries and to prepare a Balance-Sheet after redemption.

Q3. The following balances appeared in the books of Ashoka company as on 31st December

2021:

[15]

12% Mortgage Debentures Rs. 1000000 of Rs. 100 each, Sinking Fund for Redemption of Debentures Rs. 1042000, Investments: Rs. 500000 10 % Government Loan purchased at par, 560000 9% Government paper purchased for Rs. 542000.

On 28th February 2022 the investments were sold at Rs. 110 and Rs. 99 respectively. And Debentures were paid at Rs. 102 together with accrued interest. The interest on Debentures had been paid upto 31st December 2021. Prepare necessary Ledger Accounts.

2021.

Q4. Write Notes on the following:

[15]

1. Debentures issued at a discount
2. Debentures Issued at Par
3. Debentures issued at a premium

Q5A. What is Accounting Standard? Explain the Usefulness of Accounting Standard in detail. [10]

Q5B. Write a Note on AS 1 [disclosure of Accounting policy]

[05]

Q6. Write Notes on :

[15]

1. AS 2 [valuation of Inventory]
2. As 6 [Depreciation Accounting]

Q7A. What is Ratio Analysis? Explain the Utility of Ratio Analysis.

[10]

Q7B. Explain the Limitations of Ratio Analysis.

[05]

Q8. Following are the summarized Balance sheets for the two years. You are required to
Calculate the following Ratios for Two years:

[15]

Balance-Sheet

Liabilities	2021 Amount [Rs.]	2022 Amount [Rs.]	Assets	2021 Amount [Rs.]	2022 Amount [Rs.]
Share Capital:			Fixed Assets	350000	490000
Equity shares of Rs. 100 each	100000	150000	Current Assets:		
8% Preference Shares of Rs. 100 each	50000	50000	Stock	150000	60000
Reserves	200000	150000	Debtors	40000	35000
6% Debentures	100000	100000	Cash	10000	5000
Current liabilities	80000	120000			
Bank Over Draft	20000	20000			
	550000	590000		550000	590000

From the following Information Calculate

1. Current Ratio
2. Liquid Ratio
3. Acid Test Ratio
4. Proprietary Ratio
5. Long Term funds to Fixed Assets Ratio

[1/A-1G] Seat No: _____



SARDAR PATEL UNIVERSITY
B Com (II - Semester) Examination
Thursday, 6th October, 2022
9.30 am - 11.30 am

UB02ECOM01 - Advanced Accounting and Auditing - III

કુલ ગુણ : ૭૦

- નોંધ: ૧)** નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ ચાર પ્રશ્નોના ઉત્તર લખો.
૨) બધા પ્રશ્નોના ગુણ સરખા છે.

પ્ર.૧

- (અ) રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવાની કંપની ધારાની જોગવાઈઓ વર્ણવો. (૦૫)
 (બ) નીચેના સંજોગોમાં મૂડી પરત અનામત ખાતે કેટલી રકમ લઈ જવાશે તે જણાવો: (૧૦)

રિડીમેબલ પ્રેફરન્સ શેર	નવા બહાર પાડવાના શેર
૧. રૂ. ૫૦૦૦૦૦ મૂળ કિંમતે પરત કરવાના	રૂ. ૩૦૦૦૦૦ના
૨. રૂ. ૫૦૦૦૦૦, ૫% પ્રિમિયમે પરત કરવાના	રૂ. ૩૦૦૦૦૦ના
૩. રૂ. ૫૦૦૦૦૦ મૂળ કિંમતે પરત	રૂ. ૩૦૦૦૦૦, ૧૦% પ્રિમિયમે
૪. રૂ. ૫૦૦૦૦૦ મૂળ કિંમતે પરત	રૂ. ૩૦૦૦૦૦, ૧૦% વટાવે
૫. રૂ. ૫૦૦૦૦, ૫% પ્રિમિયમે પરત કરવાના	રૂ. ૩૦૦૦૦૦, ૧૦% પ્રિમિયમે

- પ્ર.૨** ભારત કંપની લિમિટેડનું તા. ૩૧ માર્ચ ૨૦૨૨ના રોજનું પાકુ સરવૈયું નીચે પ્રમાણે છે. (૧૫)

દેવાં	રકમ (રૂ.)	મિલકતો	રકમ (રૂ.)
શેરમૂડી :		કાયમી મિલકતો :	
સત્તાવાર :		જમીન અને મકાન	૭૫૦૦૦
૨૦૦૦૦ શેર રૂ. ૧૦નો એક		સાંચા અને યંત્રો	૪૫૦૦૦
૨૦૦૦૦૦		ચાલુ મિલકતો :	
ભરાયેલી :		પરચુરણ દેવાદારો	૩૫૦૦૦
૧૦૦૦૦ ઇક્વિટી શેર રૂ. ૧૦નો એક	૧૦૦૦૦૦	સ્ટોક	૨૫૦૦૦
૫%ના ૩૦૦૦ પ્રેફરન્સ શેર	૩૦૦૦૦	હાથ પર સિલક	૨૦૦૦૦
રૂ. ૧૦નો એક			
અનામત અને વધારો :			
મૂડી અનામત	૨૦૦૦૦		
સામાન્ય અનામત	૧૨૦૦૦		
નફા નુકસાન ખાતાની બાકી	૧૫૦૦૦		
ચાલુ જવાબદારીઓ અને જોગવાઈઓ :			
પરચુરણ લેણદારો	૨૩૦૦૦		
	૨૦૦૦૦૦		૨૦૦૦૦૦

કંપનીએ નક્કી કર્યું કે દરેક રૂ. ૧૦નો એવા ૨૦૦૦ ઇક્વિટી શેર રૂ. ૨ના પ્રિમિયમે રોકડા લઈને આપવા અને ૩૦૦૦, ૫%ના રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં મૂળ કિંમતે પાછા આપવા. જરૂરી આમનોંધ અને પાકુ સરવૈયું બનાવો.

પ્ર.૩ અશોકા કંપનીના ચોપડામાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ નીચેની બાકીઓ છે. (૧૫)

૧૨%ના મોર્ટગેજ ડિબેન્ટરો રૂ. ૧૦૦૦૦૦૦ના રૂ. ૧૦૦ લેખે ડિબેન્ટરો પાછા ખેંચી લેવા (પરત કરવા) માટે સિંકિંગ ફંડમાં રોકાણો રૂ. ૧૦૪૨૦૦૦ જે પૈકી રૂ. ૫૦૦૦૦૦ની ભાવોભાવ ખરીદેલી ૧૦%ની ગવર્નમેન્ટની લોન રૂ. ૫૬૦૦૦૦ના ૯%ના ગવર્નમેન્ટના પેપર રૂ. ૫૪૨૦૦૦માં ખરીદ્યા. ૨૮મી ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ રોકાણો અનુક્રમે રૂ. ૧૧૦ અને રૂ. ૯૯ના ભાવે વેચ્યા અને ડિબેન્ટરો રૂ. ૧૦૨ લેખે બાકી વ્યાજ સાથે ચુકવી દીધા. ડિબેન્ટર પરનું વ્યાજ ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી ચુકવ્યું છે. જરૂરી ખાતા તૈયાર કરો.

પ્ર.૪ નોંધ લખો : (૧૫)

૧. ડિબેન્ટર વટાવ સાથે બહાર પાડ્યા
૨. ડિબેન્ટર મૂળ કિંમતે બહાર પાડ્યા
૩. ડિબેન્ટર પ્રિમિયમ સાથે બહાર પાડ્યા

પ્ર.૫

(અ) હિસાબી ધોરણ એટલે શું ? હિસાબી ધોરણોની ઉપયોગીતા વિસ્તૃતમાં વર્ણવો. (૧૦)

(બ) નોંધ લખો : હિસાબી ધોરણ ૧ (હિસાબી નોંધ નીતિઓના પ્રગટીકરણની સમજૂતી) (૦૫)

પ્ર.૬ નોંધ લખો: (૧૫)

૧. હિસાબી ધોરણ ૨ (ઇન્વેન્ટરીનું મુલ્યાંકન)
૨. હિસાબી ધોરણ ૬ (ઘસારાની હિસાબી માવજત)

પ્ર.૭

(અ) ગુણોત્તર વિશ્લેષણ એટલે શું ? ગુણોત્તર વિશ્લેષણની ઉપયોગીતા સમજાવો. (૧૦)

(બ) ગુણોત્તર વિશ્લેષણની ગેરલાયકાતો સમજાવો. (૦૫)

પ્ર.૮ બે વર્ષના પાકા સરવૈયાના આધારે નીચે આપેલ ગુણોત્તર શોધો. (૧૫)

પાકુ સરવૈયું

જવાબદારીઓ	રકમ (રૂ.) ૨૦૨૧	રકમ (રૂ.) ૨૦૨૨	મિલકતો	રકમ (રૂ.) ૨૦૨૧	રકમ (રૂ.) ૨૦૨૨
શેરમૂડી:			કાયમી મિલકતો	૩૫૦૦૦૦	૪૯૦૦૦૦
ઇક્વિટી શેર દરેક			ચાલુ મિલકતો:		
રૂ. ૧૦૦નો	૧૦૦૦૦૦	૧૫૦૦૦૦	સ્ટોક	૧૫૦૦૦૦	૬૦૦૦૦
૮%ના પ્રેફરન્સ શેર			દેવાદારો	૪૦૦૦૦	૩૫૦૦૦
રૂ. ૧૦૦નો એક	૫૦૦૦૦	૫૦૦૦૦	રોકડ	૧૦૦૦૦	૫૦૦૦
અનામત	૨૦૦૦૦૦	૧૫૦૦૦૦			
૬%ના ડિબેન્ટર	૧૦૦૦૦૦	૧૦૦૦૦૦			
ચાલુ દેવાં	૮૦૦૦	૧૨૦૦૦૦			
બેન્ક ઓવરડ્રાફ્ટ	૨૦૦૦૦	૨૦૦૦૦			
	૫૫૦૦૦૦	૫૯૦૦૦૦		૫૫૦૦૦૦	૫૯૦૦૦૦

ઉપરની માહિતીના આધારે ગણતરી કરો :

૧. ચાલુ ગુણોત્તર
૨. પ્રવાહી ગુણોત્તર
૩. એસિડ કસોટી ગુણોત્તર
૪. માલીકી ગુણોત્તર
૫. લાંબા ગાળાના ભંડોળ સાથે કાયમી મિલકતોનું ગુણોત્તર

